

IIITમાં વિજ્ઞાનમેળો: 1000 વિદ્યાર્થીઓ ભાગ લેશે

નવગુજરાત સમય > અમદાવાદ

આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા તમને રોમાંચિત કરી દે તેવા અથવા રોજિંદા જીવનને સરળ બનાવે તેવા પ્રયોગો તૈયાર કરવામાં આવ્યા છે. ૧૨ માર્ચ શનિવારે તેના કેમ્પસ પાલજ ખાતે એક વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિજ્ઞાનમેળો આઈઆઈટીના સાયન્સ ડેની ઉજવણીનો એક ભાગ છે.

આ વિજ્ઞાનમેળામાં ૫૦ જેટલા સ્ટોલ્સ હશે. તે ઉપરાંત ફિઝિકલ રિસર્ચલેબોરેટરી, વિક્રમસારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા પણ વર્કશોપ્સ અને ડેમોન્સ્ટ્રેશન દર્શાવવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ સ્કૂલના લગભગ ૧૦૦૦ વિદ્યાર્થીઓ સહિત મુલાકાતીઓ હાજરી આપશે.